

૪(૧) ખ (૨) ઓડીટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો:-

- બી.પી.એમ.સી. એકટ ૧૯૪૮ ના પ્રકરણ ૪ ની કલમ ૪૭ અન્વયે મ્યુ.ચીફ ઓડીટરને સત્તા અને ફરજો આપવામાં આવી છે.
- સદર અધિનિયમ હેઠળ ફરજો અને મ્યુ. કોર્પોરેશનના હિસાબોની તપાસણી સંબંધી સ્થાયી સમિતિ તેને ફરમાવે તેવી ફરજના હિસાબોની તપાસણી સંબંધી સમિતિ ફરમાવે તેવી બીજી ફરજો બજાવવી.
- સ્થાયી સમિતિ વખતોવખત આપે તેવા નિર્દેશને આધિન રહીને પોતાના સીધા તાબા હેઠળના ઓડીટરો અને મદદનીશ ઓડીટરો, કારકુનોની ફરજો ઠરાવવી.
- સ્થાયી સમિતિના હુકમોને આધીન રહીને સદરહુ ઓડીટરો, મદદનીશ ઓડીટરો, કારકુનોની કાર્યવાહી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાની અને વિનિયમોને આધીન રહીને સદરહુ કર્મચારીઓની નોકરી મહેનતાણું અને તેમના અધિકારોને લગતા સઘળા પ્રશ્નોના નિકાલ કરવાનું.
- જનરલ મીટીંગના ઠરાવ નં. ૧૫૧ તા. ૨૦/૦૮/૧૯૬૮ થી ઓડીટ કાર્યપદ્ધતિ (પ્રોસીઝર) અને પાવર રેઝ્યુલેશન મંજૂર કરવામાં આવે છે.
- સ્થાયી સમિતિ ઠરાવ નં. ૫૨૧ તા. ૨૨/૦૭/૭૭ થી કોન્ટ્રાક્ટરના ફાયનલ બીલનું પ્રી ઓડીટીંગનું કામ મ્યુ. ચીફ ઓડીટરશ્રીને સોંપવામાં આવેલ છે.
- વહીવટદાર ઠરાવ નં. ૨૫૭૬ તા. ૧૪/૦૬/૭૫ અન્વયે મ્યુ. ચીફ ઓડીટરશ્રીને ખાતાના વહીવટી કામો માટે સત્તાઓ આપવામાં આવી છે.
- માસિક સાધારણ સભાના ઠરાવ નં. ૮૧/૨૦૨૦ તા. ૩૦/૦૩/૨૦૨૦ મુજબ નીચેની કામગીરી સોંપવામાં આવી છે.
 - (૧) ર લાખ થી વધુ રકમના પ્રથમ રનીગ બીલોનું પ્રિ—ઓડીટીંગનું કામ મ્યુ. ચીફ ઓડીટરશ્રીને સોંપવામાં આવેલ છે.
 - (૨) મ્યુનિસિપલ ફરજના ઓડીટ કરવાની હાલની પ્રથા સાથે પ્રિ—ઓડીટ (રનીગ બીલ) તેમજ પોસ્ટ ઓડીટ (ફાઈનલ બીલ) સંદર્ભે સેન્ટ્રલાઈઝ ઓનલાઈન સીસ્ટમ ધ્વારા તમામ ઓબજેક્શન/વાંધાઓ જે તે ઓન/ખાતા લેવલે દર્શાવી તેમજ પ્રથમ રનીગ બીલ તેમજ ફાઈનલ બીલમાં ટેકનીકલ મુદ્દાઓ બાદ કરી ફક્ત નાણાંકીય બાબતોનું ઓડીટ કરી દિન—૧૫ માં નિકાલ કરવો.
 - (૩) સ્થાયી સમિતિ ઠરાવ નં. ૧૬૬૮, તા. ૧૬/૦૧/૧૯૯૨ માં હાલમાં મુખ્ય અન્વેષકશ્રી ધ્વારા હિસાબોનું પ્રિ—ઓડીટ કરવામાં આવે છે તે પ્રથા તા. ૦૧/૦૪/૧૯૯૭ થી ૨૬ કરવી તથા તે સઘળી કામગીરી હિસાબી ખાતા ધ્વારા કરવી જેવા શબ્દો ૨૬ કરી તેટલા અંશે મજકૂર ઠરાવમાં આંશિક સુધારો કરવામાં આવે છે.
- ઉપર જણાવેલ કલમો ઉપરાંત સ્થાયી આદેશો / ઠરાવો હેઠળની કામગીરી કરવા માટે ઓડીટ ખાતાના નીચે જણાવેલ મંજૂર સ્ટાફ શિડ્યુલ મુજબના કર્મચારીઓને કામની વહેંચણી કરેલ છે.

ક્રમ	હોદ્દો	સંખ્યા	પુરાયેલ સંખ્યા	ખાલી
------	--------	--------	----------------	------

૧	મુખ્ય અન્વેષક	૧	૧	—
૨	નાયબ અન્વેષક	૩	૧	૨
૩	મદદનીશ અન્વેષક	૨	૦	૨
૪	સેક્શન ઓફીસર	૧	૦	૧
૫	પ્રથમ શ્રેણી ઓડીટ કલાર્ક	૮	૩	૫
૬	બીજી શ્રેણી ઓડીટ કલાર્ક	૧૩	—	૧૩
૭	ત્રીજી શ્રેણી ઓડીટ કલાર્ક	૩૨	૩૧	૧
૮	જમાદાર	૧	૦	૧
૯	પટાવાળા	૮	૧	૭
	કુલ સંખ્યા	૬૮	૩૭	૩૨

ઉપર જણાવ્યા મુજબ કુલ – ૬૮ જગ્યાઓ પૈકી તમામ કેડર મળીને કુલ – ઉર જગ્યા ખાલી પડે છે.

હ્યાત ઓડીટ સ્ટાફમાંથી નીચે જણાવેલ અધિકારીઓ અને તેમને સોંપેલ સ્ટાફ પાસે ઓડીટની કામગીરી સોંપવામાં આવી છે અને તેમને સોંપેલ કામગીરીને લગતી સત્તા સોંપવામાં આવી છે તેમજ તેઓ ધ્વારા કરવામાં આવતી કામગીરીને અનુરૂપ ફરજો નક્કી થાય છે.

❖ મ્યુનિ. ચીફ ઓડીટર :– શ્રી સિમત એચ. શેઠ – ઓડીટ ખાત

ઓડીટખાતાના ચારેય વિભાગ જેવા કે, ટ્રેઝરી, મહેકમ, ખર્ચ (કન્ટીજન્સી) અને રેવન્યુ વિભાગના અધિકારીઓ અને તેઓના હાથ નીચેના સ્ટાફને તેમને અનુરૂપ કામગીરી સોંપવાનું અને તેઓના કામને લગતી ફરજો નક્કી કરવાનું છે. મહાનગરપાલિકાના ડિસાબોની ઓડીટ સંબંધિત નીતિ નિયમો અને ઓડીટ કાર્યપદ્ધતિ સ્થાયી સમિતિના નિર્દેશો/હુકમો/ઠરાવોને આધીન નક્કી કરવાનું અને અમલીકરણ કરવાનું છે. મહત્વની બાબતો અંગે અભિપ્રાય આપવાનું, કાયદાકીય જોગવાઈ અનુસાર સ્થાયી સમિતિ અને સામાન્ય સમા સમક્ષ માંગણી સમયાનુસાર રીપોર્ટ/જવાબ રજૂ કરવાનું.

(અ) નાયબ અન્વેષક :– શ્રીમતી મિનાજ સાયરસ સુરતી :– ટ્રેઝરી વિભાગ

(૧) અઠવાડિક આવક જાવકનું ઓડીટ કરી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા અર્થે મુખ્ય અન્વેષકશ્રી પ્રતિ રવાના કરવા બાબત અને (૨) ગ્રાંટનું ઓડીટ કરી મુખ્ય અન્વેષકશ્રી પ્રતિ રવાના કરવા બાબત તથા (૩) મુખ્ય અન્વેષકશ્રી તરફથી આપવામાં આવતી અન્ય કામગીરી.

(બ) ઈ.ચા.સેક્શન ઓફીસર :– શ્રી એન. એમ. દોરડી – મહેકમ વિભાગ

સેક્શન ઓફીસરના હાથ નીચેના કર્મચારીઓને સોંપેલ કામગીરી ઉપર દેખરેખ રાખવાનું, માર્ગદર્શન આપવું, જુદા જુદા ખાતાઓના કર્મચારીઓના (૮૩૦૦-૩૪૮૦૦) ગ્રેડ – પે ૪૬૦૦ સુધીના પગાર

ધોરણ મેળવતા) રજા, ઈજાફાના કાગળોને તેમની હાથ નીચેના કર્મચારીઓએ કરેલ છે, તેની અંશતઃ ચકાસણી કરી પરત રવાના કરવાના શેરા ઉપર સહી કરવાનું, મુખ્ય અન્વેષકશ્રીનું તેમના હાથ નીચેના કર્મચારીઓની કામગીરીનો અહેવાલ આપવાનો તેમજ તેમના હાથ નીચેના કર્મચારીઓએ ઉપસ્થિત કરેલ વાંધા / નોંધની ખરાઈપણાની ચકાસણી બાદ રીપોર્ટ મુખ્ય અન્વેષકશ્રી સમક્ષ રજુ કરવાનું માંગણી થયેથી મુખ્ય અન્વેષકશ્રીની સુચનાને આધીન મહાનગરપાલિકાના નોકરી/સેવા તેમજ કર્મચારીઓના પગાર /પેન્શન અને અન્ય સેવકીય લાભો સંબંધિત બાબતો પર અભિપ્રાય આપવાની કામગીરી.

અનું. નં.	કર્મચારી નું નામ	કામગીરીની વિગત
૧.	શ્રી સિમત એચ. શેઠ	મુખ્ય અન્વેષકની કામગીરી
૨.	શ્રીમતી મિનાજ સાયરસ સુરતી	દ્રેઝરીની કામગીરી
૩.	શ્રી નેકજાદ મરગુલાન દોરડી	મહેકમ (એસ.બી અને પેન્શન ફાઈલ) અને કન્ટીજન્સીની કામગીરી
૪.	શ્રી સુનીલકુમાર રમેશચંદ્ર મિસ્ત્રી	કન્ટીજન્સી અને મહેકમની કામગીરી
૫.	શ્રી મહેશકુમાર નારાયણ કોષ્ટી	રેવન્યુ (સ્પોટ ટીમ) અને મહેકમની કામગીરી
૬.	શ્રી મેહુલ દિપકભાઈ શાહ	ઓડિટખાતાની ભરતી તેમજ બઢતી અંગેની કામગીરી, બજેટ તૈયાર કરવા અંગેની કામગીરી, ડેડસ્ટોક રજીસ્ટર રાખવાની કામગીરી, પરિપત્રો, નોંધના જવાબો આપવાની કામગીરી, મહેકમની બાબતે લગતા કમિશનરશ્રી વિ. તરફથી માંગેલ અભિપ્રાય તૈયાર કરી સેકશન ઓફિસરશ્રી સમક્ષ રજૂ કરવા. પગાર તફાવત(ડીફરન્સ સ્ટેટમેન્ટ) ની ફેર ચકાસણી.પેન્શન ગ્રેજ્યુલ્ટીની ફાઈલની ફેર ચકાસણી તથા મહેકમ (કર્મચારીના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ). દ્રેઝરી (બેંક રીકન્સીલીએશન, ગ્રાંટ, તેમજ ઓડીટ રીપોર્ટ). કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૭.	શ્રી નિધિ એસ. લોચાવાળા	કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ તથા હેડ કલાર્કની મહેકમ સંબંધિત કામગીરીમાં સહાયક. કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૮.	શ્રી પ્રજોશકુમાર ડી. પટેલ	કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ તથા હેડ કલાર્કની મહેકમ સંબંધિત કામગીરીમાં સહાયક. કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૯.	શ્રી ચિંતનકુમાર ડે. પટેલ	એસેસમેન્ટ, ફિઝીકલ વેરીફિકેશન, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ) અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૧૦.	શ્રી પંકજકુમાર એસ. પાટીલ	એસેસમેન્ટ, ફિઝીકલ વેરીફિકેશન, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ) અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૧૧.	શ્રી કમલેશ કુમાર પી. રબારી	કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ તથા હેડ કલાર્કની મહેકમ સંબંધિત કામગીરીમાં સહાયક. કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૧૨.	શ્રી નિમેષકુમાર બી. સોલંકી	એસેસમેન્ટ, ફિઝીકલ વેરીફિકેશન, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના

		બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૨૬.	શ્રી હાર્દિકકુમાર એસ. કાતરીયા	સ્પોટ ટીમમાં અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૨૭.	શ્રી અફજલહુસેન જેડ. સૈયદ	એસેસમેન્ટ, ફિઝીકલ વેરીફીકેશન, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ) અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૨૮.	શ્રી હિતેશકુમાર બી. પટેલ	ટ્રેઝરી વિભાગની કામગીરી, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ) અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૨૯.	શ્રી ખુશભુબેન કે. પટેલ	સ્પોટ ટીમમાં અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૦.	શ્રી હિતેશકુમાર એચ. કહાર	પેન્શન ગ્રેજ્યુઇટીની ફાઈલોનું પ્રી.ઓડીટ તેમજ રજા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ. કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૧.	શ્રી અનિલકુમાર એચ. ખૂંટ	સ્પોટ ટીમમાં અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૨.	શ્રી વંદનાબેન આર. જાદવ	કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ તથા હેડ કલાર્કની મહેકમ સંબંધિત કામગીરીમાં સહાયક. કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૩.	શ્રી રાહુલકુમાર જે. પટેલ	એસેસમેન્ટ, ફિઝીકલ વેરીફીકેશન, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ) અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૪.	શ્રી નિકિતાબેન પી. પટેલ	પેન્શન ગ્રેજ્યુઇટીની ફાઈલોનું પ્રી.ઓડીટ તેમજ રજા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ. કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૫.	શ્રી હર્ષબેન એન. પ્રજાપતિ	ટ્રેઝરી વિભાગની કામગીરી, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ) અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૬.	શ્રી ભૌતિક એ. ઘામેલિયા	ટ્રેઝરી વિભાગની કામગીરી, મહેકમ (પેન્શન ફાઈલની પ્રી ઓડીટ કરવાની કામગીરી તથા કર્મચારીઓના રજા તથા ઈજાફાના કાગળોનું પોસ્ટ ઓડીટ) અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)
૩૭.	શ્રી કુનાલકુમાર ડી. દેસાઈ	સ્પોટ ટીમમાં અને કન્ટીજન્સીની કામગીરી (કોન્ટ્રાક્ટરના બીલ્સ / સિક્યોરીટી ડીપોઝીટ અભિપ્રાય)